

આથી ખાસ કરીને દેવાદાર(રો) અને જામીનદાર(રો) અને જાહેર વનતાને જાણ કરવામાં આવે છે કે નીચે જણાવેલ સ્થાવર અને જંગમ મિલકતો સિક્યોર્ડ લેણદારને ગોરો /ચાર્જ કરાયેલ છે, જેનો બેંક ઓફ બરોડા, સિક્યોર્ડ લેણદારના અધિકૃત અધિકારીએ **કબજો** લઈ લીધો છે, જેનું વેચાણ નીચે જણાવેલ કોર્ટ(ઓટર/ટેની વડુતાલ માટે **“બ્યાં છે”, “બે છે”, “બેમ છે”** કોર્ટપણ **આશ્રય આધાર વિનાના ધોરણે ૧૩.૦૭.૨૦૨૬** ના રોજ કરવામાં આવશે. દેવાદાર/રો/જામીનદાર/રો/ સિક્યોર્ડ મિલકત/તો/બાકી રકમ/ રીઝર્વ કિંમત/ઇ-હરાજુની તારીખ અને સમય, ઇએમડી અને બીડવૃદ્ધિની રકમ નીચે જણાવેલ છે:

ઈ-હરાજુની તારીખ અને સમય ૧૩.૦૭.૨૦૨૬ ના રોજ સવારના ૧૧.૦૦ કલાકથી બપોરના ૦૨.૦૦ કલાક દરમિયાન (પ્રત્યેક ૫ મિનિટના અમર્યાદિત વધારા સહિત) વાહન નિરિક્ષણની તારીખ અને સમય ૧૦.૦૭.૨૦૨૬ સમય : સવારે ૧૧:૦૦ થી બપોરના ૦૨:૦૦ સુધી

દેવાદાર / ડિરેક્ટરો અને જામીનદારોનું નામ અને સરનામું / શાખા	બાકી લેણાં	વાહનોની વિગત	રીઝર્વ કિંમત ઈએમડી વાહનના બીડ વધારા રકમ	શાખા મેનેજર / અધિકૃત અધિકારીનો સંપર્ક નંબર
દેવાદાર : શ્રીમતી ઇશા જયરાજસિંહ પરીહર એ-૪૦૨૨, સનરાઈઝ હોમ, વટવા કેનાલ રોડ, લાંબા નારોલ, રેઈન્જી હાઈટરૂઝની પાસે, અમદાવાદ સીટી, અમદાવાદ. શાદીબાગ શાખા	કુલ બાકી રકમ રૂા. ૩,૭૨,૨૨૮.૦૦ + ભવિષ્યનું વ્યાજ + અન્ય ચાર્જ-રહિત વસુલાત અત્યાર સુધી એપીએસ તારીખ : ૦૫.૦૧.૨૦૨૫	RENAULT INDIA PVT. LTD. Registration No.: GJ-27-EA-5669 Body Colour : ICE COOL WHITE Chassis Number : MEEBBA006N3808237 Engine Number : B4DA416E053646 Encumbrance known to bank : BOB	રીઝર્વ કિંમત : રૂા. ૧,૭૬,૬૦૦/- ઈએમડી: ૧૭,૬૬૦/- બીડ વૃદ્ધિ રકમ: રૂા. ૧૦,૦૦૦/-	પ્રગથા તિવારી ૮૪૨૮૮૦૨૧૫૯

વેચાણના વિસ્તૃત નિયમો અને શરતો માટે, કૃપા કરીને <https://bankofbaroda.bank.in/e-auction વેબસાઈટ લિંક અને Baanknet.com> ઓનલાઇન હરાજુ પોર્ટલોનું સંદર્ભ લો/મુલાકાત લો. વધુમાં, સંબંધિત બિડર્સ અધિકૃત અધિકારીનો સંપર્ક કરી શકે છે અને support.baanknet@psballiance.com અને support.baanknet@procure247.com સહાય માટે ઇમેઇલ કરી શકે છે. ટેકનીકલ સમસ્યાઓ માટે **સંપર્ક વિગતો baanknet.com, સંપર્ક વિગતો baanknet.com, મો. ૬૩૫૪૯૧૦૧૨ અને ૯૯૧૩૩૪૫૫૩૬ (જંગમ/સ્થાવર મિલકતનાં વેચાણ પર સરકારી કાયદા પ્રમાણે લાગુ પડતું જીએસટી/ટીડીએસ ખરીદનારે ચૂકવવા પાત્ર છે.) સંપર્ક વ્યક્તિ : શ્રી મનોજ કુમાર ગુપ્તા મો. ૯૦૨૪૩૩૮૦૪૨**

શરતો અને નિયમો :

- ઓનલાઈન ઈ-ઓક્શન ઓક્શન પોર્ટલ વેબસાઈટ એટલે કે <https://baanknet.com> દ્વારા ઉપર જણાવેલ તારીખ અને સમયે ૧૦ મિનિટના અમર્યાદિત એક્સટેન્શન સાથે ચોજવામાં આવશે. ઇચ્છુક બિડર્સ / ખરીદદારોએ તેમના મોબાઇલ નંબર અને માન્ય ઇમેઇલ-આઈડીનો ઉપયોગ કરીને <https://baanknet.com> (ખરીદનાર નોંધણી - વેબસાઇટના હોમ પેજમાં આપેલી લિંક) દ્વારા નોંધણી કરાવવાની જરૂર છે. ઇચ્છુક બિડર્સ / ખરીદદારોએ KYC દસ્તાવેજો અને બેંક વિગતો અપલોડ કરવાની જરૂર છે. હરાજુ પોર્ટલ વેબસાઇટના હોમ પેજમાં આપેલી ખરીદદાર મેન્યુઅલ દ્વારા ઇચ્છુક બિડર્સ/ખરીદદારોને માર્ગદર્શન આપી શકાય છે.
- KYC વેરિફિકેશન - નોંધણી પૂર્ણ થવા પર, ઇચ્છુક બિડર્સ/ખરીદનારાઓએ KYC દસ્તાવેજો અને બેંક ખાતાની વિગતો અપલોડ કરવાની જરૂર છે. નોંધણી અને અપલોડ કરવાની પ્રક્રિયાઓ અગાઉથી સારી રીતે પૂર્ણ કરવી જોઈએ.
- EMD ચૂકવણી - KYC વેરિફિકેશન પૂર્ણ થવા પર, ઇચ્છુક બિડર/ખરીદનારા લોગિન કરી શકે છે અને EMD પેમેન્ટ કરી શકે છે , EMD પેમેન્ટ માટે ઇચ્છુક બિડર/ખરીદનારને ખરીદદાર તરીકે લોગિન કર્યા પછી તેમાં આપેલ ખરીદદાર મેન્યુઅલ દ્વારા માર્ગદર્શન આપી શકાય છે. ચૂકવણી પેમેન્ટ ગેટવે દ્વારા અને ચલણ બનાવવાના માર્ગ દ્વારા અને વોલેટમાં રકમ જમા કરીને પણ કરી શકાય છે. નિર્ધારિત સમય પહેલાં ચૂકવણી સારી રીતે સુનિશ્ચિત કરવામાં આવશે. જો જરૂરી EMD રકમ ખરીદનાર વોલેટમાં રાખવામાં નહીં આવે , તો તેમને ભાગ લેવાની મંજૂરી આપવામાં આવશે નહીં. રસ ધરાવનાર બિડર ઈ-ઓક્શન બંધ થતાં પહેલાં <https://baanknet.comAuction> પોર્ટલ પર પ્રી-બિડ ઈચ્છુ જમા કરી શકે છે. જમા કરાવેલ બચાનના નાણા પર કોઈ વ્યાજ લાગશે નહીં. અસફળ બિડર્સના EMD ના રિફંડ માટે, બિડરે <https://baanknet.com> માં લોગિન કરીને ઈ-ઓક્શન સેવા પ્રદાતા પાસેથી ઓનલાઇન રિફંડ મેળવવાનું રહેશે અને ખરીદનાર મેન્યુઅલમાં આપેલી રિફંડ માટેની પ્રક્રિયાને અનુસરશે અને ઓનલાઈન રિફંડ માંગ્યા પછી જ રિફંડ મળશે. ઈ-ઓક્શન સેવા પ્રદાતા દ્વારા કરવામાં આવશે. અસફળ બિડર્સની EMD રકમ વ્યાજ વગર પરત કરવામાં આવશે.
- બિડ કરતી વખતે બિડરે તો પ્રોપર્ટી પસંદ કરવી પડશે જેના માટે ઉપરોક્ત વેબસાઈટમાં દર્શાવેલ ચાદીમાંથી ઓફર સબમિટ કરવામાં આવી છે અને/અથવા બિડર સીદા જ પ્રોપર્ટી આઈડી દાખલ કરી શકે છે.

હેલ્પ ડેસ્ક

- પ્રશ્નો માટે સંપર્ક નંબર: **૮૨૯૧૨૨૨૦૨૦** અને ઇમેઇલ **ID.support.BAANKNET@psballiance.com**

- નોંધણી અને લોગિન અને બિડિંગ નિયમો માટે <https://baanknet.com> ના હોમ પેજમાં આપેલી ખરીદનાર મેન્યુઅલ લિંકની મુલાકાત લો.

હરાજુ મિલકત સંબંધિત પ્રશ્નો માટે, બિડર્સ છેલ્લા પેરામાં આપેલી સંપર્ક વિગતો પર બેંક અધિકારીઓનો સંપર્ક કરી શકે છે.

સામેલ પત્રો -

- મોબાઈલ નંબર અને ઈમેલ આઈડીનો ઉપયોગ કરીને <https://baanknet.com> પર નોંધણી કરો.
- જરૂરી KYC દસ્તાવેજો અપલોડ કરો.
- પેમેન્ટ ગેટવે દ્વારા અને ચલણ જનરેટ કરીને EMD રકમ ચૂકવો અને બિડરના EMD વોલેટમાં EMD રકમ ટ્રાન્સફર કરો.
- બિડરના ઈ-વોલેટમાં EMD રકમ પ્રતિબિંબિત થયા પછી, બિડરને ચોક્કસ મિલકતના "ભાગીદારી" વિકલ્પ પર ક્લિક કરીને હરાજીમાં ભાગ લેવાની જરૂર છે.
- હરાજીની તારીખ અને સમય પર બિડ સબમિશન ઓનલાઈન મોડ દ્વારા કરવામાં આવશે.
- સફળ બિડના કિસ્સામાં, બાકીની બિડરની રકમ અર્થે દર્શાવેલ શરતો અનુસાર ચૂકવવાની રહેશે.
- સબમિટ બિડના બિડની કિંમત અનામત કિંમતની સમકક્ષ અથવા તેનાથી વધુ હોવી જોઈએ અને ઈ-ઓક્શન દરમિયાન બિડર્સને છેલ્લી બિડની ઉપર અને તેની ઉપર અને બિડની રકમમાં ન્યૂનતમ વધારો કરીને ઈન્ટર-સે બિડિંગમાં ઊંચી બિડ ઓફર કરવાની મંજૂરી આપવામાં આવશે. બિડર્સની છેલ્લી ઊંચી બિડને કોષ્ટકમાં આપવામાં આવે છે. અધિકૃત અધિકારી દ્વારા નક્કી કરાયેલ અનામત કિંમતથી નીચે મિલકત વેચવામાં આવશે નહીં. અનામત કિંમતથી નીચે આવેલ બિડ નકારવામાં આવશે. બિડર્સ જાહેર વેચાણ સૂચના/વેચાણની શરતો અને શરતોમાં ઉલ્લેખિત રકમના ગુણાકારમાં તેમની બિડ વધારશે. છેલ્લી દસ મિનિટમાં બિડની પ્રાપ્તિના કિસ્સામાં ૧૦ મિનિટનો સમય અમર્યાદિત એક્સટેન્શન આપવામાં આવશે. બિડર્સને ક્રમિક ઉચ્ચ બિડને ક્વોટ કરવા માટે દસ મિનિટનો સમય આપવામાં આવશે અને જો છેલ્લી સૌથી વધુ બિડની દસ મિનિટની મુદત પછી કોઈપણ બિડર દ્વારા કોઈ ઊંચી બિડ ઓફર કરવામાં આવશે નહીં, તો ઈ-ઓક્શન બંધ કરવામાં આવશે.
- ઇચ્છુક બિડર્સને સલાહ આપવામાં આવે છે કે તેઓ વેચાણની સૂચના, ઈ-ઓક્શનના નિયમો અને શરતો, ઈ-ઓક્શનના ઓપરેશનલ ભાગ પર હેલ્પ મેન્યુઅલને ગોચર રીતે વાંચે અને તેનું યુસ્તપણે પાલન કરે.
- અધિકૃત અધિકારી દ્વારા ઈ-ઓક્શનને આખરી સ્વરૂપ આપ્યા પછી, સફળ બિડરને અમારા ઉપરોક્ત સેવા પ્રદાતા દ્વારા સેવા પ્રદાતા સાથે નોંધાયેલા ઈમેલ એડ્રેસ પર ઈમેલ દ્વારા જાણ કરવામાં આવશે.
- સફળ હરાજી ખરીદનાર/બિડરને બિડની રકમના ૨૫% (પચાસ ટકા) (એટલે કે અગાઉ જમા કરવામાં આવેલી EMD રકમ સહિત) હરાજીની સમાપ્તિ પર તરત જ જમા કરાવવાની રહેશે એટલે કે તે જ દિવસે અથવા પછીના કામકાજના દિવસ પછી નહીં. ચૂકવવાપાત્ર બિડ ખરીદ કિંમતની બાકીની રકમ સફળ હરાજુ ખરીદનાર/બિડર દ્વારા અધિકૃત અધિકારીને મિલકતના વેચાણની પુષ્ટિના પંદરમા દિવસે અથવા તે પહેલાં ચૂકવવામાં આવશે અથવા ખરીદનાર અને ખરીદનાર વચ્ચે લેખિતમાં સંમત થઈ શકે તેવી વિસ્તૃત અવધિ. સુરક્ષિત લેણદાર, કોર્ટપણ કિસ્સામાં ત્રણ મહિનાથી વધુ નહીં. નિર્ધારિત સમયની અંદર ઉપરોક્ત ઉલ્લેખિત રકમ જમા કરાવવામાં નિષ્ફળતાના કિસ્સામાં, સફળ બિડર દ્વારા જમા કરવામાં આવેલી રકમ બેંકમાં જતમ કરવામાં આવશે અને અધિકૃત અધિકારીને મિલકતની નવી હરાજુ/વેચાણ કરવાની સ્વતંત્રતા રહેશે અને કસ્ટોડિયાર બિડર જતમ કરેલી રકમ અને મિલકત પર કોઈ દાવો નથી.
- ચૂકવણીમાં ડિફેર: ઉપર જણાવ્યા મુજબ તે જ દિવસે અથવા બીજા કામકાજના દિવસે બિડની રકમના ૨૫% (ઓછી EMD) ની ડિફેર ચૂકવણી અને/અથવા નિર્ધારિત સમયની અંદર બેલેન્સ બિડની રકમના ૭૫% વેચાણ આપ રદ થશે. કોર્ટપણ સૂચના વિના. સફળ બિડર દ્વારા ચૂકવવામાં આવેલ EMD અને અન્ય કોર્ટપણ નાણાં અધિકૃત અધિકારી દ્વારા બેંકને જતમ કરવામાં આવશે.
- સફળ બિડર દ્વારા બેંકને વેચાણની વિચારણાની ચૂકવણી આવકવેરા અધિનિયમ ૧૯૬૧ની કલમ ૧૮૪-૧A હેઠળ ટીડીએસને આદીન રહેશે અને TDS સફળ બિડર દ્વારા માત્ર બાકીના ૭૫% જમા કરાવતી વખતે જ કરવાની રહેશે. બિડ રકમ. સફળ હરાજુ ખરીદનાર/બીડરે બિડની રકમ પર બેંકને લાગુ પડતો GST ચૂકવવો પડશે.
- સંપૂર્ણ વેચાણ વિચારણા પ્રાપ્ત થયા પછી, અધિકૃત અધિકારી નિયમો અનુસાર વેચાણ પ્રમાણપત્ર જારી કરશે. ખરીદનાર સ્ટેમ્પ ડ્યુટી સહન કરશે, જેમાં વેચાણ પ્રમાણપત્ર, નોંધણી ચાર્જ, સરકાર/કોર્ટપણ સત્તાધિકારીને ચૂકવવાપાત્ર તમામ વૈદ્યાનિક લેણાં, કર, GST અને દરો અને મિલકતો સંબંધિત વર્તમાન અને ભાવિ બંનેનો સમાવેશ થાય છે.
- વેચાણ પ્રમાણપત્રમાં બિડમાં ઉલ્લેખિત નામો સિવાયના નામોના સમાવેશ/ફેરબદલી માટેની કોર્ટપણ વિનંતીને ધ્યાનમાં લેવામાં આવશે નહીં. વેચાણ પ્રમાણપત્ર ફક્ત સફળ બિડરના નામે જ આપવામાં આવશે.
- ડીઆરટી/ડીઆરએટી/હાઈકોર્ટ અથવા અન્ય કોર્ટ દ્વારા વેચાણ પ્રમાણપત્રના ઇચ્છૂ સામે પસાર કરાયેલા કોર્ટપણ સ્ટે/મનાઈ હુકમ/સંચાનના હુકમની બાકી કામગીરી બાકી હોય વેચાણ પ્રમાણપત્ર જારી કરવામાં આવશે નહીં. વધુમાં આ સમયગાળા દરમિયાન જતમ કરવામાં આવેલી રકમ પર કોર્ટ વ્યાજ ચૂકવવામાં આવશે નહીં. બિડર બિડ દ્વારા કરવામાં આવેલી ડિપોઝિટ, વેચાણ પ્રમાણપત્રના અમલીકરણ માટે બાકી, બિન-વ્યાજ ધરાવતા ડિપોઝિટ ખાતામાં રાખવામાં આવશે. ડિપોઝિટ પરત કરવા માટેની કોર્ટપણ વિનંતીને આંશિક રીતે અથવા સંપૂર્ણ/વેચાણ પરત કરવાની વિનંતીને ધ્યાનમાં લેવામાં આવશે નહીં. DRT/DRAT/હાઈકોર્ટ અથવા અન્ય કોર્ટ દ્વારા આગળની કાર્યવાહી પર સ્ટે મુકવાના કિસ્સામાં, હરાજુ કાં તો સ્થગિત અથવા રદ થઈ શકે છે અને વેચાણમાં ભાગ લેનાર વ્યક્તિઓને આવી મુલતવી અથવા રદ કરવા માટે નુકસાની, વળતર અથવા ખર્ચનો દાવો કરવાનો કોર્ટ અધિકાર નથી.
- અધિકૃત અધિકારી/બેંક પાસે કોર્ટપણ બિડ સ્વીકારવાનો અથવા નકારવાનો અથવા વેચાણને મુલતવી રાખવાનો/મુલતવી રાખવાનો/રદ કરવાનો/સેલના કોર્ટપણ નિયમો અને શરતોમાં ફેરફાર કરવાનો સંપૂર્ણ અધિકાર છે. જો અગાઉની બિડર કામગીરી કરવા માટે નિષ્ફળ જાય તો.
- ઇચ્છુક ખરીદનાર તેના/તેણીના ખર્ચે ઉપર જણાવેલ તારીખ અને સમયે મિલકતની તપાસ કરી શકે છે. ટાઇટલ દસ્તાવેજ અને બેંક પાસે ઉપલબ્ધ અન્ય દસ્તાવેજોની તપાસ માટે, ઇચ્છુક બિડર હરાજીની તારીખના ઓછામાં ઓછા બે દિવસ પહેલાં ઓફિસ સમય દરમિયાન બેંક ઓફ બરોડા શાખાનો સંપર્ક કરી શકે છે.
- મિલકતનું વેચાણ “બેમ છે ત્યાં છે”, “બેમ છે તેમ” અને “બે ત્યાં છે”ના આધારે કરવામાં આવી રહ્યું છે અને ઇચ્છુક બિડરોએ તેમની પોતાની વિવેકપૂર્ણ સ્વતંત્ર પૂરવણી કરવી જોઈએ અને સંબંધિત રજિસ્ટ્રાર/એસઆરઓ/રેવન્યુ ડેકોર્સ/ની ચકાસણી કરવી જોઈએ. અન્ય વૈદ્યાનિક સત્તાવાળાઓ કોર્ટપણ સત્તાના બીજા અને દાવાઓ/હકો/લેણાઓ/ચાર્જસ જેવા કે વેચાણલેણ, બેંકના ચાર્જ ઉપરાંત એક્સાઈઝ/જીએસટી/આવક વેરો અને તેમની બિડ સબમિટ કરતા પહેલાં મિલકત પર ટાઇટલ વેરણ, નાણા, હદ, ગુણવત્તા, જથ્થા, શરત, બોજ, પૂર્વાધિકાર, ચાર્જ, વૈદ્યાનિક લેણાં વગેરે અંગે પોતાને સંતુષ્ટ કરશે. ઈ-ઓક્શનની જાહેરાત કોર્ટ પ્રતિબદ્ધતા અથવા બેંકની કોર્ટપણ સ્વૂઆતની રચના કરતી નથી અને માનવામાં આવશે નહીં. અધિકૃત અધિકારી/સુરક્ષિત લેણદાર કોર્ટપણ તૃતીયા પક્ષના બીજો/દાવાઓ/અધિકારો/લેણાઓ માટે કોર્ટપણ રીતે જવાબદાર રહેશે નહીં. ઓનલાઈન બિડ સબમિટ કર્યા પછી મિલકત પર વેચાણ ચાર્જ/બોજ અથવા અન્ય કોર્ટ બાબત વગેરે માટે મૂકવામાં આવેલ મિલકતની કોર્ટપણ પ્રકારના દાવાને ધ્યાનમાં લેવામાં આવશે નહીં.
- બેંક વેચાણ માટે ઓફર કરવામાં આવેલી મિલકતના સંબંધમાં કોર્ટપણ પરવાનગી/લાયસન્સ, ડ્રૌ વગેરે મેળવવાની જવાબદારી લેતી નથી. અધિકૃત અધિકારી/સુરક્ષિત લેણદાર બાકી પાણી/સેવા શુલ્ક, ટ્રાન્સફર ફી, વીજળીના લેણાં, મ્યુનિસિપલ કોર્પોરેશન/સ્થાનિક સત્તા/કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીના બાકી લેણાં અથવા અન્ય કોર્ટપણ લેણાં, કર, રસૂલાત, ફી જેવા કોર્ટપણ લેણાં માટે જવાબદાર રહેશે નહીં. , આ મિલકતના વેચાણના સંબંધમાં આવેલા સંબંધમાં જો કોર્ટ હોય તો ટ્રાન્સફર ફી. સફળ બિડરે મિલકતની ખરીદી અંગે આવકવેરાની જોગવાઈઓનું પાલન કરવું પડશે અને લાગુ પડતા દરો મુજબ સત્તાવાળાઓને કર ચૂકવવો પડશે.
- અધિકૃત અધિકારીને દરેક કેસના તથ્યો અને સંજોગોના સંદર્ભમાં જરૂરી લાગતી કોર્ટ પણ શરતોમાં સુધારો/ફેરફાર/ડિલીટ કરવાની સ્વતંત્રતા રહેશે. બેંક/અધિકૃત અધિકારીને કોર્ટ પણ બિડ સ્વીકારવાનો કે નકારવાનો અથવા વેચાણને મુલતવી રાખવા/મુલતવી રાખવા/રદ કરવાનો સંપૂર્ણ અધિકાર અને મુનસફી છે/ વેચાણના કોર્ટ પણ અને અને શરતોમાં કોર્ટ આગોતરી જાણ કર્યા વિના અને કોર્ટ કારણ સુપરસ્ટ કર્યા વિના તેમાં ફેરફાર કરવાનો સંપૂર્ણ અધિકાર અને મુનસફી છે. બિડરોએ વેચાણની તમામ શરતો વાંચી અને સમજૂ હોવાનું માનવામાં આવશે અને તે જ દ્વારા બંધાયેલા છે. બોલી લગાવનાર અને/અથવા સફળ-બોલી લગાવનાર દ્વારા કોર્ટ પ્રતિ-ઓફર/શરતી ઓફર/શરતી સ્વીકારવામાં આવશે નહીં. અહીં ઉપર ઉપયોગમાં લેવાયેલા શબ્દો અને અભિવ્યક્તિઓના સમાન અર્થો સરકારી અધિનિયમ, ૨૦૦૨ અને તે હેઠળ ઘડવામાં આવેલા નિયમોમાં અનુક્રમે તેમને સૌપવામાં આવ્યા છે.
- વેચાણ સિક્યોર્ડી કેડિટર બેંક દ્વારા પુષ્ટિને આદીન છે.
- વેચાણ સરકારી એક્ટ ૨૦૦૨ અને તેમાં વડાચેલા સિક્યોરિટી ઇન્ટેરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) રૂલ્સ, ૨૦૦૨ ના નિયમોમાં નિર્ધારિત શરતો/નિયમો/જોગવાઈઓ અને ઉપર જણાવેલ નિયમો અને શરતોને આદીન છે. વધુ વિગતો માટે જો કોર્ટ સંબંધિત બોલી લગાવનાર અધિકૃત અધિકારી **શ્રી મનોજ કુમાર ગુપ્તા મો. ૯૦૨૪૩૩૮૦૪૨** નો સંપર્ક કરી શકે છે.